

**B.A. Semester - 6 (CBCS) Examination****March/April -2019****ECONOMICS : P22 BANKING AND FINANCIAL MARKET - 2(CORE - 22)****Time: 2:30 Hours****Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન-૧ ભારતમાં વ્યાપારી બેંકોના રાષ્ટ્રીયકરણ માટેના કારણોની વિગતે ચર્ચા કરો. (૧૪)  
અથવા
- પ્રશ્ન-૧ વિકાસબેંક એટલે શું? વિકાસબેંકોની લાક્ષણિકતાઓ ચર્ચો.
- પ્રશ્ન-૨ ભારતમાં બિન-બેંકિંગ નાણાકીય સંસ્થાઓના લક્ષણો ચર્ચો. (૧૪)  
અથવા
- પ્રશ્ન-૨ શાખ નિયંત્રણના પરિમાણાત્મક સાધનોની વિગતે ચર્ચા કરો.
- પ્રશ્ન-૩ નાબાર્ડના હેતુઓ અને કાર્યો સમજાવો. (૧૪)  
અથવા
- પ્રશ્ન-૩ રાષ્ટ્રીયકૃત વ્યાપારીબેંકોના વિકાસ - પ્રગતિની ચર્ચા કરો.
- પ્રશ્ન-૪ સેબીના કાર્યો વિશે વિગતે ચર્ચા કરો. (૧૪)  
અથવા
- પ્રશ્ન-૪ ભારતમાં ૧૯૮૧ પછી બેંકિંગક્ષેત્રે થયેલા સુધારાઓ વર્ણવો નરસિંહમ કમિટીની મુખ્ય ભલામણો જણાવો.
- પ્રશ્ન-૫ ટુંકનોંધ લખો (કોઈપણ બે) (૧૪)
- (1) ભારતમાં સ્ટોક એક્ચેન્જ
  - (2) વિદેશીબેંકોનું મહત્વ
  - (3) ભારતીય નાના ઉદ્યોગની વિકાસ બેંક - SIDBI
  - (4) ભારતીય જીવન વિમા નિગમ - LIC

**English Version**

- Que-1 Discuss in detail the causes of nationalization of commercial banks in India. (14)  
OR
- Que-1 What is development Bank? Discuss the characteristics of development banks.
- Que-2 Discuss the characteristics of non - banking financial institution in India. (14)  
OR
- Que-2 Discuss in detail the quantitative credit control.
- Que-3 Explain the objectives and functions of NABARD. (14)  
OR
- Que-3 Discuss the progress of nationalized commercial banks.
- Que-4 Discuss in detail the functions of SEBI. (14)  
OR
- Que-4 Discuss reforms in Banking sector after 1991 in India. Narrate the main recommendations of Narsinham Committee.
- Que-5 Write Short notes (Any Two) (14)
- (1) Stock exchange in India.
  - (2) Importance of Foreign Banks.
  - (3) SIDBI
  - (4) LIC

\*\*\*\*\*